



Henry Ford Health System (HFHS) દરેક દર્દી સાથે ગરિમાપૂર્વક, આદરપૂર્વક અને લાગણીપૂર્વક વર્તે છે. HFHS દ્વારા વાજબી કિંમતે પ્રદાન કરાતી તબીબી સેવાઓ અને દર્દીઓને તેમના તબીબી ખર્ચોને સંચાલિત કરવા માટે વિકલ્પો શોધવામાં સહાયતા કરવા માટે દર્દીઓ તેના તરફ ધ્યાન દોરી શકે છે.

તમે અમારા Patient Financial Assistance Program (દર્દી નાણાકીય સહાયતા કાર્યક્રમ, PFAP) મારફતે તમારા તબીબી બિલમાં મદદ મેળવવાને પાત્ર હોઈ શકો છો.

### હું PFAP માટે કેવી રીતે પાત્ર હોઈ?

PFAP માટે પાત્ર હોવા માટે તમારે અમુક આવશ્યકતાઓની પૂર્તિ કરવી આવશ્યક છે. આ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે.

પાત્રતા માપદંડ	પદ્ધતિ 1	પદ્ધતિ 2a	પદ્ધતિ 2b
યુ.એસ. સિટિઝન અથવા કાયદેસર રહેવાસી	X	X	X
મેકોમ્બ, ઓક્લેન્ડ અથવા વેઈન કાઉન્ટીમાં રહે છે	X	X	X
HFHS પ્રદાતા દ્વારા HFHS ખાતે નિદાન થયેલ	X	X	X
આરોગ્ય વીમા માટે પાત્ર નથી	X		
સમવાય ગરીબી રેખાના 250% થી ઓછી આવક છે	X	X	
મર્યાદિત નાણાકીય સ્ત્રોતોથી વીમાકૃત		X	X
HFHS તબીબ બિલ્સ ધરેલુ આવકના 30% કરતા વધુ છે		X	X

\*અમે ઉપર સૂચિબદ્ધ નથી તેવા માપદંડના આધારે પાત્રતા પૂર્વલક્ષી અસર માટે દર્દીઓની તપાસ કરી શકીએ છીએ.

જો તમે પદ્ધતિ 1 અથવા 2a માટે માપદંડની પૂર્તિ કરતા હોય, તો તમને પાત્ર તબીબી સેવાઓ પર 100% છૂટ પ્રાપ્ત થઈ શકે છે.

જો તમે પદ્ધતિ 2b માટે માપદંડની પૂર્તિ કરતા હોય, તો તમારું પાત્રતા તબીબી ઋણ તમારી ધરેલુ આવકનું 30% જેટલું ઓછું થઈ શકે છે.

જો તમે આ પદ્ધતિઓમાંથી કોઈપણ માપદંડની પૂર્તિ કરતા નથી, તો તમારી પાસેથી આરોગ્ય વીમો કવરેજ ધરાવતા હોય તેવા દર્દીઓને સામાન્ય રીતે બિલ આપવામાં આવે છે તેના કરતા વધુ શુલ્ક લેવામાં આવશે નહીં.

### હું PFAP માટે કેવી રીતે અરજી કરું?

PFAP માટે અરજી કરવા માટે, તમાર દર્દી નાણાકીય સહાયતા કાર્યક્રમ અરજી પૂર્ણ ભરવી અને સહાયક દસ્તાવેજો પ્રદાન કરવા આવશ્યક છે. તમને તમારું પ્રથમ બિલ પ્રાપ્ત થાય પછી અરજી કરવા માટે તમને 240 દિવસ મળે છે. HFHS ને તમારી પૂર્ણ ભરેલ અરજી પ્રાપ્ત થાય, પછી તમને 30 દિવસની અંદર લેખિતમાં નિર્ણય આપવામાં આવશે.

### હું વધુ જાણકારી કેવી રીતે મેળવું?

વધુ માહિતી માટે અથવા અમારી પૂર્ણ નીતિ અને/અથવા અરજીની મફત કૉપિ મળવવા માટે, કૃપયા:

- [www.henryford.com/financialassistance](http://www.henryford.com/financialassistance) પર વેબસાઈટ પર જાઓ
- અમારા નોંધણી સ્ટાફ અથવા નાણાકીય નેવિગેટર સાથે સંપર્ક મળીને અથવા કૉલ કરીને વાત કરો:
  - Henry Ford Hospital અને Medical Centers (Cottage Medical Center): (313) 916-4510
  - Henry Ford Wyandotte Hospital અથવા Brownstown Medical Center: (734) 246-9516
  - Henry Ford West Bloomfield Hospital: (248) 325-0201
  - Henry Ford Macomb Hospitals (Clinton Township અને Mount Clemens): (586) 263-2696
  - Henry Ford Kingswood Hospital અને Maplegrove Center: (313) 874-9501